



આણંદ કૃષિ યુનિવર્સિટી

કૂડ પોસેસીંગ ટેકનોલોજી તાલીમની પ્રવેશ અંગેની જાહેરાત

અભ્યાસક્રમનું નામ તથા મુદ્દત	“કૂડ પોસેસીંગ ટેકનોલોજી” વિષય પર ત્રણ (03) મહિનાના સમયગાળાનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ
અભ્યાસક્રમનું સ્થળ	આચાર્યશ્રી, કોલેજ ઓફ કૂડ પોસેસીંગ ટેકનોલોજી એન્ડ બાયો એન્જીનિયરિંગ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - ૩૮૮ ૧૧૦
શૈક્ષણિક લાયકાત	ગુજરાત રાજ્ય સ્થીત શાળા / બોડીમાંથી ધોરણ-૧૦ (દસ) પાસ
ઉંમર	તા. ૨૦/૧/૨૦૨૫ ના રોજ ૧૫ થી ૪૦ વર્ષ
પ્રવેશક્ષમતા	૨૫ (પચ્ચીસ) બેઠકો
અનામત બેઠકો	ગુજરાત સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર
અરજી કરવા અંગેની વિગત	પ્રવેશ મેળવવા અંગેનું નિયત અરજીફોર્મ વિનામૂલ્યે આચાર્યશ્રીની કચેરીમાંથી તેમજ યુનિવર્સિટીની વેબસાઇટ www.aau.in પરથી ડાઉનલોડ કરી સ્વપ્રમાણિત કરેલ શૈક્ષણિક લાયકાતના આપારો સાથે અભ્યાસક્રમના સ્થળે જ મોકલવાનું રહેશે.
અરજી સ્વીકારવાની તેલ્લી તારીખ અને વધુ માહિતી માટેનો ફોન નંબર	તા. ૨૦/૧/૨૦૨૫ સાંજના ૧૫:૦૦ કલાક સુધીમાં ઓફિસ નં. ૦૨૬૬૨-૨૬૧૩૦૨ (સવારે ૮ થી ૧૨ અને ૨ થી ૫ વાગ્યા સુધી)

વિસ્તરણ શિક્ષણ નિયામક

(માહિતી/આણંદ/661/24-25)

ત્રણ મહિનાના સમયગાળાનો

સ્ટીલિકેટ ક્રેખ

ઓન

ક્રડ પ્રોસેસીંગ ટેકનોલોજી

માહિતી પુસ્તિકા



કોલેજ ઓફ ક્રડ પ્રોસેસીંગ ટેકનોલોજી એન્ડ બાયો એન્જીનિયરિંગ
આણંદ કૃષી યુનિવર્સિટી
આણંદ - ૩૮૮૧૧૦.

સર્ટીફીકેટ કોર્સ ઓન ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી

કોલેજ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી એન્ડ બાયો એન્જીનીઝ
આણંદ કૃષી યુનિવર્સિટી, આણંદ

પાસપોર્ટ
સાઈઝનો
તાજેતરનો
ફોટોગ્રાફ

પ્રવેશ અંગેનું અરજી ફોર્મ

૧.	ઉમેદવારનું પુરેપુરુષ નામ	:	
૨.	પિતા/વાલીનું પુરેપુરુષ નામ	:	
૩.	જે કિસ્સામાં ઉમેદવારના પિતા જીવિત હોય ત્યારે વાલી સાથેનો સંબંધ:		
૪.	કાચમી સરનામુ	:	
	તાલુકો..	જુલ્લો:	પીન કોડ:
૫.	હાલનું સરનામુ	:	
	તાલુકો.	જુલ્લો:	પીન કોડ:
	રહેઠાણનો ટેલીફોન/મો. નંબર	:	
૬.	ઉમેદવારના વતનના જુલ્લાનું નામ:		
૭.	જન્મ તારીખ (અંકડા તથા શબ્દોમાં):		
૮.	જાતિ/પેટા જાતિ	:	
૯.	અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પણત વર્ગ (બક્ષીપંચ)		
૧૦	ના હોય તો તેની વિગત:	:	
૧૦	પરણિત કે અપરણિત	:	

૧૧.	શૈક્ષણિક લાયકાત :
-----	-------------------

પાસ કરેલી પરીક્ષા	પરીક્ષા પાસ કરેલ બોર્ડ/યુનિવર્સિટીનું નામ	પરીક્ષા પાસ કર્યાનું વર્ષ	પરીક્ષામાં મેળવેલ ગુણાની વિગત
			મેળવેલા કુલ ગુણ ટકા%
ધોરણ-૧૦			
ધોરણ-૧૨			
સ્નાતક			
અનુસ્નાતક			

૧૨.	તમારા પિતા/વાલી તમારા વતનના જીલ્લા સિવાયના અન્ય જીલ્લાની જાહેર સંસ્થામાં નોકરી કરે છે? જો "હા" તો જાહેર સંસ્થાનું નામ તથા સરનામું/વાલીનો હોક્કો લખવો.

૧૩.

તાલીમાર્થીની બાહેધરી

આથી હું બાહેધરી આપુ છુ કે, જો મને સ્ટીફીકેટ કોર્ષ ઓન ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજીમાં દાખલ કરવામાં આવશે તો હું કભૂલાત આપુ છુ કે જે કોઈ નિયમો કે ધારાધોરણો આ અભ્યાસક્રમ માટે હાલ અમલમાં છે અથવા ભવિષ્યમાં કરવામાં આવશે તે બધાનું હું તાલીમાર્થી હોઉ ત્યાં સુધી પાલન કરવા બંધાઉ છું. કેન્દ્રના નિયમિત સંચાલન કે શિસ્તને બાધ્ય કરે તેવું કોઈપણ કાર્ય હું કેન્દ્રની અંદર કે બહાર કરીશ નહિ.

ઉમેદવારની સહી.....

૧૪.

ઉમેદવારના પિતા/વાલીએ આપવાની બાહેધરી

આથી હું બાહેધરી આપુ છુ કે, જો મારા પુત્ર/પુત્રી/પાત્યને સ્ટીફીકેટ કોર્ષ ઓન ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવશે તો કેન્દ્રની અંદર કે બહાર મારા પુત્ર/પુત્રી/પાત્યની તમામ પ્રકારની વર્તણુંક માટે હું જવાબદાર છું તેમજ તેની/તેણીની વર્તણુંક બરાબર ન હોય અથવા અભ્યાસક્રમમાં હાજરી ઘટશે તો સંસ્થા જે પગલા લેશે તે મને મંજુર છે.

તારીખ :

સ્થળ :

ઉમેદવારના પિતા/વાલીની સહી.....

૧૫. અરજી ફોર્મ સાથે સામેલ કરવાની વિગતો:

1. શાળા છોડ્યાના પ્રમાણપત્રની પ્રમાણિત/સ્વપ્રમાણિત નકલ.
2. ધોરણ-૧૦ પરીક્ષાની માર્કશીટની તેમજ અન્ય શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રોની પ્રમાણિત/સ્વપ્રમાણિત નકલો.
3. ઉમેદવાર અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ/સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (બક્ષીપંચ) ના હોય તો તેવી જાતિના જે તે જીત્યાના સમાજકલ્યાણ અધિકારીશ્રી અથવા મામલતદાર/સક્ષમ અધિકારીશ્રીના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ.
4. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (બક્ષીપંચ) વર્ગના ઉમેદવારોએ ઉજ્જ્વલ વર્ગમાં સમાવેશ થતો નથી, તે મુજબનું સરકારશ્રીના સક્ષમ અધિકારીશ્રીના સંલગ્ન વર્ગના પ્રમાણપત્રની પ્રમાણિત નકલો.

“સર્ટીફીકેટ કોર્ઝ ઓન ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી”ના પ્રમાણપત્ર અભ્યાસક્રમનાં પ્રવેશ, હાજરી વિ.ના વિનિયમો

ફૂડ પ્રોસેસીંગ વિષય એક ઉભરતું ક્ષેત્ર છે. સાંપ્રત સમયમાં મૂલ્યવર્ધિત ઉચ્ચ ગુણવત્તાસભર બનાવટોની ઘર આંગાણે તેમજ બહાર માંગ ખૂબ જ છે. જે આવતા સમયમાં ખૂબ જ ઝડપથી આગળ ધપવાનું છે. આપણા દેશમાં ફળ-શાકભાજનું વિપુલ ઉત્પાદન હોવા છતાં તેનું મૂલ્યવર્ધિત બનાવટોમાં રૂપાંતર ખૂબ જ ઓછુ છે. જેનું એક કારણ આ ક્ષેત્રમાં અપૂરતું પ્રશિક્ષિત માનવબળ છે. આથી ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રમાં કુશળ માનવબળ પ્રાયોગિક તથા પ્રશિક્ષણ દ્વારા ઉભુ કરવાની ખાસ જરૂરીયાત છે. આણંદ કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓક ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી એન્ડ બાયો એનજી ખાતે ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રમાં કુશળ માનવબળ તૈયાર થાય તે હેતુથી ત્રણ મહિનાનો સર્ટીફીકેટ કોર્ઝ “ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી” નો પ્રમાણપત્ર અભ્યાસક્રમ ચલાવવામાં આવશે.

(૧) ઉદ્દેશ : “ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી” સર્ટીફીકેટ કોર્ઝનો મુખ્ય ઉદ્દેશ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ માટે બોધ્યિક તેમજ પ્રાયોગિક તાલીમ દ્વારા કુશળ માનવબળ તૈયાર કરવાનું છે.

(૨) સ્થળ : કોલેજ ઓક ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી એન્ડ બાયો એનજી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ.

(૩) અભ્યાસક્રમ : સર્ટીફીકેટ કોર્ઝ ઓન ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી ત્રણ (૩) માસનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ છે. જેમાં બોધ્યિક તેમજ પ્રાયોગિક કાર્ય શીખવવામાં આવશે. આ અભ્યાસક્રમમાં પાકની કાપણી પદ્ધિની તાંત્રિકતાઓ અને તેનું નુકશાન ધરાડવાના ઉપાયો/પગલા, જુદી જુદી મૂલ્યવર્ધિત બનાવટોનું પ્રાયોગિક કાર્ય દ્વારા સમજ અને જાતે બનાવવાની તાલીમ, વિવિધ બનાવટોની જાળવણી/સાચવણી વિગેરે બાબતો અંગેનો અભ્યાસમાં સમાવેશ કરવામાં આવશે.

(૪) અરજી ફોર્મ :

ઉમેદવારે અરજી સાદા કાગળમા કરવાની રહેશે અને અરજી ફોર્મ સાથે નીચે મુજબના બિડાણ (પ્રમાણપત્રો) સામેલ કરવાના રહેશે.

- (અ) ધોરણ-૧૦ પરીક્ષા પાસ અને તે ઉપરાંત વધારાની લાયકાત ધરાવતા ગુણપત્રકોની પ્રમાણિત નકલો.
- (બ) ઉંમરના પૂરાવા માટે શાળા છોક્કાના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ.

- (ક) ઉમેદવાર અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત (બક્ષીપંચ) વર્ગના હોય તો તેવી જાતિ સબબના જે તે તાલુકા મામલતદાર/ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી/સક્ષમ અધિકારીશ્રીના પ્રમાણપત્રોની નકલ.
- (સ) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની બેઠકોમાં ઉજ્જત વર્ગમાં સમાવેશ થતો ન હોય તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ઉમેદવારો જ પ્રવેશપત્ર રહેશે. આ બાબતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો એ ઉજ્જતવર્ગમાં સમાવેશ થતો નથી તે મતલબનું સરકારના સક્ષમ અધિકારીશ્રીનું માન્યતા પ્રાપ્ય સમયગાળાનું નોન-કિમીલેયર પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અરજી સાથે રજુ કરવાની રહેશે.
- (ઇ) કોઈ સંસ્થા તરફથી મોકલવામાં આવનારા ઉમેદવારે તે સંસ્થાના ભલામણપત્ર તથા કામગીરીના અનુભવ અંગેનું પ્રમાણપત્ર (સંસ્થાના છાપેલ લેટર હેડ પર રજુ કરવાનું રહેશે.

(૫) પ્રવેશ :

કૂડ પ્રોસેસીંગ ટેકનોલોજીનાં ત્રણ મહિનાનાં પ્રમાણપત્ર અભ્યાસક્રમમાં પ્રવેશ અંગેની જરૂરી વિગતો નીચે મુજબ છે.

(૫.૧) શૈક્ષણિક લાયકાત :

સર્ટીફીકેટ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારે ઓછામાં ઓછા ધોરણ-૧૦ (દસ) ગુજરાત રાજ્ય સ્થિત શાળા / બોર્ડ માંથી પાસ હોવા જોઈએ.

(૫.૨) ઉંમર :

પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારની ઉંમર સત્ર શરૂ થવાના દિવસે ૧૫ થી ૪૦ વર્ષ સુધીની હોવી જોઈએ.

(૫.૩) અનામત :

પ્રવેશ માટે અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (બક્ષીપંચ) ઉમેદવારો માટે પ્રવર્તમાન નીતિ-નિયમો અનુસાર બેઠકો અનામત રાખવામાં આવશે. આ અનામત બેઠકો માટે પૂરતા ઉમેદવારો નહીં મળે તો સામાન્ય અગ્રતાક્રમ ચાદી (જનરલ મેરીટ લીસ્ટ) મુજબ કમાનુસાર ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે.

(૫.૪) રૂબરૂ મુલાકાત (ઇન્ટરવ્યુ) :

પ્રવેશ મેળવવા માટે કોલેજ ઓફ ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી અને બાયો એનજી, આણંદની કચેરીને નિયત સમય મર્યાદામા મળેલ અરજુઓમાંથી માન્ય અરજુઓવાળા ઉમેદવારોની યોગ્યતા /અગ્રતાકમના ધોરણે યાદી તૈયાર કરી ઉમેદવારોને સ્વખર્યે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યુના દિવસે હાજર રહેલ ઉમેદવારોનું ઇન્ટરવ્યુ (રૂબરૂ મુલાકાત) પસંદગી સમિતી દ્વારા લેવામાં આવશે. જેમાં પસંદ થયેલ ઉમેદવારોને પ્રવેશ અપાશે. રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવનાર ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત સમયે અરજુફોર્મમાં જણાવ્યા મુજબનાં અસલ પ્રમાણપત્રો/માર્કશીટ રજુ કરવાના રહેશે. તેમજ જે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારીશ્રીનું શારીરીક યોગ્યતા પુરવાર કરતું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. પસંદગી પામેલ ઉમેદવારોએ કોલેજ ઓફ ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી અને બાયો એનજી, આણંદની કચેરીમાં કોશન મની/ફી ની રકમ તુરંત ભરવાની રહેશે.

(૬) પ્રવેશની ક્ષમતા: આ કોર્સમાં ૨૫ બેઠકો ભરવામાં આવશે.

(૭) કોર્સનું માધ્યમ ગુજરાતી રહેશે.

પ્રવેશ આપવા માટે ઉમેદવારની પસંદગી કરવા માટે નીચે મુજબની પસંદગી સમિતી રહેશે.

(અ) અધ્યક્ષ : વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, આ.કૃ.યુ., આણંદ,

(બ) કન્વીનર : આચાર્યશ્રી, કોલેજ ઓફ ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી એન્ડ બાયો એનજી, આ.કૃ.યુ., આણંદ.

(ક) સભ્ય સચિવ: સર્ટીફીકેટ કોર્સ ઓન ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજીના ઇન્ડ્યાર્જશ્રી.

(૮) પ્રવેશ અંગેની જાહેરાત રાજ્ય કક્ષાનાં કોઇપણ ગુજરાતી દૈનિક સમાચારપત્રમાં અખ્યાસક્રમ શરૂ થતા અગાઉ એક માસ પહેલા પ્રસ્તુત કરવામાં આવશે.

(૯) પ્રતિ વર્ષ ૧(એક) તાલીમ અથવા જરૂરીયાત મુજબ ૨(બે) તાલીમ વર્ગ યોજવામાં આવશે.

સટીફીક્રેટ કોર્સ

ઓન

ડ્રડ પ્રોસેસિંગ ટેકનોલોજી

ત્રણ મહિનાના સમયગાળાનો
“સર્ટીફીકેટ કોર્ષ ઓન ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી”

અ.નં.	વિષય	અભ્યાસક્રમની વિગત	કેડીટ
૧.	કૌશલ્ય વિકાસ અને સંચાલન	<p>પાકોની લણણી બાદની પદ્ધતિઓ</p> <p>કલીનીંગ (સફાઈ પ્રક્રિયા), વોશિંગ (ધોવાણ કરવાની પ્રક્રિયા), સોર્ટિંગ (ભૌતિક લાક્ષણીકતાઓ આધારિત વર્ગીકરણ), ગ્રેડિંગ (ગુણવત્તા આધારિત વર્ગીકરણ), સેપરેશન (અલગ કરવાની પ્રક્રિયા), ડિકોર્ટિક્ટિંગ (છાલ-ફોતરી ઉખાડવાની પ્રક્રિયા), શેલીંગ (બાધ્ય પડ તોડવાની પ્રક્રિયા), મિલિંગ (પીસવું), પેકેજિંગ, સ્ટોરેજ (સંગ્રહ)</p> <p>ફૂડ પ્લાન્ટ કાર્યાન્વિત પદ્ધતિઓ</p> <p>ઉત્પાદન માટેની યોજના</p> <p>ઉત્પાદન માટે કાર્યક્ષેત્ર, મશીનરી અને સાધનોની સાફ્સફાઈ અને જાળવણી, ઉત્પાદન માટે ગોઠવણી</p> <p>કાર્યસ્થળ પર સંરક્ષણ પદ્ધતિઓ</p> <p>સામગ્રી સંરક્ષણ પદ્ધતિ, ઉજ્જ / વીજળી સંરક્ષણ પદ્ધતિ</p> <p>અસરકારક કચરા વ્યવસ્થાપન/ રીસાઈકલીંગ (પુનર્ઉપયોગ કરવાની પ્રક્રિયા)</p> <p>ખાદ્ય ઉત્પાદન પદ્ધીની સાફ્સફાઈ અને સાધનોની નિયમિત જાળવણી</p> <p>ઉદ્યોગસાહસ્રિકતાનો વિકાસ</p> <p>સરકારી માર્ગદર્શિકા, FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા), GMP (ગૂડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ), PMFME (પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસીંગ એન્ટરપ્રાઇઝ સ્કીમ) યોજનાઓ, આયાત-નિકાસ નીતિ લાઈસન્સિંગ</p> <p>FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા), MSME (મિનીસ્ટ્રી ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટપ્રાઇઝીસ) હેઠળ નોંધણી અને લાઈસન્સ પ્રક્રિયાની સમજણ</p> <p>ખાદ્ય ઉત્પાદનોના પેકેજિંગ માટે ખાદ્ય સુરક્ષા, સ્વચ્છતા</p>	૫(૫+૦)

		<p>ભેટસેળની તપાસ, AGMARK (એગ્રીકલ્ચર માર્કેટીંગ) અને BIS (બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ્સ) ધોરણો માટે મસાલાનું પરીક્ષણ,</p> <p>ભેટસેળની તપાસ અને FPO (કુટ પ્રોડક્ટ્સ ઓર્ડર) સ્પષ્ટીકરણ માટે જામ, જેલી જેવા ફળ ઉત્પાદનોનું પરીક્ષણ સંપૂર્ણ ડોક્યુમેન્ટેન્સ (દસ્તાવેજુકરણ)ની દેખરેખ અને રેકૉર્ડની જગતવણી</p> <p>કાચા માલ અને પ્રક્રિયા કરેલ ખાદ્ય ઉત્પાદનો</p>	
૨.	ફળો અને શાકભાજુનું નિર્જલીકરણ/ સૂકવણી	ફળો અને શાકભાજુની સુકવણી / નિર્જલીકરણ વોશિંગ (ધોવાણ કરવાની પ્રક્રિયા), સોર્ટિંગ (ભૌતિક લાક્ષેણીકતાઓ આધારિત વર્ગીકરણ), પીલીંગ (છાલ ઉતારવી), સ્લાઇસિંગ (સ્લાઇસ પાડવાની પ્રક્રિયા), બ્લાન્યિંગ (નિખારવાની પ્રક્રિયા), જુદીજુદી સુકવણી/નિર્જલીકરણની પ્રક્રિયાઓ, નિરીક્ષણ, પેકિંગ, સ્ટોરેજ (સંગ્રહ)	૩(૦+૩)
૩.	જ્યુસ અને ઝવોશ પ્રોસેસીંગ	વિવિધ ફળમાંથી ફળોના પલ્યનું ઉત્પાદન વોશિંગ (ધોવાણ કરવાની પ્રક્રિયા), સોર્ટિંગ (ભૌતિક લાક્ષેણીકતાઓ આધારિત વર્ગીકરણ), પીલીંગ (છાલ ઉતારવાની પ્રક્રિયા), ડિસોનીંગ (બીજ અલગ પાડવાની પ્રક્રિયા), ડિસ્ટોનીંગ (પથ્થર જેવા પદાર્થોનો નિકાલ કરવાની પ્રક્રિયા), નિર્જર્ષણ, પ્રિકુકીંગ, સ્ટરીલાઇઝન (વંધ્યોકરણ), પાસ્ચ્યુરાઈઝન (પાશ્ચરીકરણ), કલેરીફાઈંગ (અશુદ્ધિઓ કાઢવાની પ્રક્રિયા), કેનિંગ, ફિલિંગ (ભરવું), પેકિંગ, સ્ટોરેજ (સંગ્રહ)	૨(૦+૨)
૪.	જામ, જેલી અને કેચઅપ પ્રોસેસીંગ	જામ, જેલી અને કેચઅપ બનાવવાની પ્રક્રિયા જામ, જેલી અને કેચઅપનું પેકિંગ, સ્ટોરેજ (સંગ્રહ)	૧(૦+૧)
૫.	પિકલ અને પેસ્ટ પ્રોસેસીંગ	વિવિધ પ્રકારના અશાણા અને પેસ્ટનું ઉત્પાદન વોશિંગ (ધોવાણ કરવાની પ્રક્રિયા), સોર્ટિંગ (ભૌતિક લાક્ષેણીકતાઓ આધારિત વર્ગીકરણ), પીલીંગ (છાલ ઉતારવી), સ્લાઇસિંગ (સ્લાઇસ પાડવાની પ્રક્રિયા), બ્રાઇન સોલ્યુશનની તૈયારી, ક્યોરિંગ (સાચવણી પ્રક્રિયા), પેકેજીંગ, સ્ટોરેજ (સંગ્રહ) મુરબ્બા બનાવવાની પદ્ધતિ	૨(૦+૨)

૬.	મસાલા પ્રોસેસીંગ	મસાલા અને સીજનીંગ (પકવણી)નું ઉત્પાદન આખા મસાલાનું ઉત્પાદન, મસાલા અને કરી પાવડરનું ઉત્પાદન, સીજનીંગ (પકવણી), વ્રેપિંગ (વીટાળવું), લેબલીંગ (લેબલ ચોટાડવું)	૧(૦+૧)
૭.	ગ્રેઇન મિલિંગ (અનાજ પીસવાની પ્રકિયા)	મિલિંગ માટે અનાજની પૂર્વ-પ્રકિયા અનાજ, કઠોળ અને તૈલી પદાર્થોનું મિલિંગ વેટ મિલિંગ (ભીનું પીસવાની પ્રકિયા), ડ્રાઇ મિલિંગ (સુંકું પીસવાની પ્રકિયા)	૧(૦+૧)
૮.	અનાજ આધારિત ઉત્પાદનોનું પ્રોસેસીંગ (પ્રસંસ્કરણ)	મકાઈમાંથી મૂલ્યવર્ધિત બનાવટોનું ઉત્પાદન કલીનીંગ (સફાઈ પ્રકિયા), વેટ મિલિંગ (ભીનું પીસવાની પ્રકિયા), નોન-ડીજમિંગ (બિન- ઉપકરણ પ્રકિયા), ટેમપરિંગ, ડ્રાઇ મિલિંગ (સુંકું પીસવાની પ્રકિયા), પેકેજીંગ મકાઈના તેલનું ઉત્પાદન મકાઈના તેલનું નિષ્કર્ષણ, શુદ્ધિકરણ અને પેકેજીંગ જીવાર અને મકાઈ ફ્લેક્સનું ઉત્પાદન કાચા માલની ઓળખ અને અનાજની તૈયારી ફ્લેકડ અનાજ બનાવી કોટિંગ કરવાની કામગીરી મકાઈ ફ્લેક્સનું પેકેજીંગ, સ્ટોરેજ (સંગ્રહ) પોપકોર્ન, ફ્લેકડ રાઈસ, પફડ રાઈસ અને ન્યુડલ્સનું ઉત્પાદન, મીલેટ્સમાથી મૂલ્યવર્ધિત ઉત્પાદનોની પ્રકિયા	૨(૦+૨)
૯.	સોયા ઉત્પાદનોનું પ્રોસેસીંગ (પ્રસંસ્કરણ)	વિવિધ આકારો અને કદ ધરાવતા સોયા પ્રોટીનનું ઉત્પાદન સોયા આધારિત પીણા અને પનીર (ટોકું)નું ઉત્પાદન	૧(૦+૧)
૧૦.	તળેલા ખાદ્યખોરાકોનું પ્રોસેસીંગ (પ્રસંસ્કરણ)	અનાજ અને કઠોળ આધારિત તળેલા ખાદ્યખોરાકોનું ઉત્પાદન સંગ્રહશક્તિનું નિર્ધારણ અને પેકેજીંગ, સ્ટોરેજ (સંગ્રહ)	૨(૦+૨)
૧૧.	ઔદ્યોગિક સંપર્ક	નાના પાચા પર સંચાલિત ફ્લૂ પ્રોસેસીંગ ઉદ્યોગો / ગૃહ ઉદ્યોગો / એફ્ફીઓ (ખેડૂત ઉત્પાદક સંગઠન)માં ઔદ્યોગિક સંપર્ક મુલાકાત (૨ અઠવાડિયા)	S
કુલ કેડીટ = ૨૦			૨૦ (૦૫+૧૫)

સામાન્ય નિયમો

(૧) નીચે જણાવ્યા પ્રમાણેની બાબતો તાલીમાર્થાઓની અશિસ્તને ગેરવર્તણુક તરીકે ગણવામાં આવશે અને તે અંગે શિક્ષાત્મક પગલા નિયમોનુસાર કોલેજના આચાર્યશ્રી લઇ શકશે.

- ૧.૧ યુનિવર્સિટી વિસ્તારમાં દાહક, સ્કોટક, તીક્ષ્ણ કે વિનાશક હથિયારો રાખે કે તેનો ઉપયોગ કરે તો.
- ૧.૨ માદક, કેફી કે ઝેરયુક્ત પદાર્થો રાખે કે તેનો ઉપયોગ કરે તો.
- ૧.૩ અન્ય તાલીમાર્થાને હેરાનગાતિ / પરેશાની કે બિભત્તસ વર્તન કરે અથવા કરાવે તો.
- ૧.૪ સંસ્થાનનું હિત જોખમાય તેવી પ્રવૃત્તિઓ જેવી કે સલા, દેખાવ, હડતાલ, જુથબંધી કે સરધસ કરે / કાઢે તો.
- ૧.૫ યુનિવર્સિટીની અસ્કયામતો, મિલ્ક્ટોને કોઈપણ પ્રકારનું નુકશાન, ભાંગફેસ કે ચોરી કરે તો.
- ૧.૬ યુનિવર્સિટીના નિયમો, આદેશ કે સુચનાઓનો અનાદર કે ઉલ્લંઘન કરે તો.
- ૧.૭ અન્ય તાલીમાર્થાને અભ્યાસમાં ખલેલ પહોંચાડે તો.
- ૧.૮ શિક્ષણ કાર્ય, પરીક્ષાની પ્રવૃત્તિઓનો બહિજાર/અવરોધ કરે તો.
- ૧.૯ યુનિવર્સિટીની બેઠકો, રમત-ગમત સાસ્કૃતિક કે અન્ય કાર્યક્રમોમાં અવરોધ કરે તો.
- ૧.૧૦ કોઈ પણ તાલીમાર્થાઓની ચીજ-વસ્તુ/રોકડ રકમની ચોરી કરે તો.
- ૧.૧૧ યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ, શિક્ષકો, કર્મચારીઓ સાથે ગેરવર્તાવ કરે તો.
- ૧.૧૨ સંસ્થાની મુલાકાતે આવનાર મુલાકાતીઓ, કર્મચારીઓના કુટુંબીજનો, સંસ્થાના મહેમાનો કે અન્ય સંસ્થાના વિદ્યાર્થીઓ સામે અગવડતા ઉભી કરે, મુશ્કેલી ઉભી કરે, ઉશ્કેરાઇ જાય, ઇજા કે નુકશાન કરે તો.

૧.૧૩ સંસ્થાના સાધનો, વીજળી પ્રવાહ, પાણી વગેરેનો દુરૂપયોગ કરે તો.

૧.૧૪ નિયત કરેલ ગણવેશ પહેરીને ન આવે તો.

૧.૧૫ શંકાશીલ ચાલ-ચલગત જણાય તો.

(૨) તાલીમાર્થાઓની અશિસ્ત, ગેરવર્તાવ, ગેરવર્તણુંક બાબતોમા કોલેજના આચાર્યશ્રી આવા તાલીમાર્થાઓને સાંભળ્યા પછી યોગ્ય નિર્ણય લઇ નીચેના શિક્ષાત્મક પગલા લઇ શકશે.

૨.૧ ગુન્હાની ગંભીરતા મુજબ રૂ.૫૦૦/- સુધીનો દંડ.

૨.૨ યુનિવર્સિટીની અસ્ક્યામતોને જેટલું નુકશાન પહોચાડ્ય હોઇ તેની પ્રવર્તમાન કિંમતની વસુલાત ઉપરાંત દંડ કરી શકશે.

૨.૩ યુનિવર્સિટીની અસ્ક્યામતોની ચોરી કરી હોય તેવા કિસ્સામાં ગુન્હાની ગંભીરતા જોઇ તેની વસુલાત ઉપરાંત દંડ કરી શકાશે અથવા જરૂર જણાય તો કાનૂની કાર્યવાહી કરી શકાશે.

૨.૪ અભ્યાસમાંથી બરતરફી.

(૩) અભ્યાસમાંથી બરતરફ કરવાનાં સંજોગો ઉપસ્થિત થાય તો તેવા કિસ્સામાં તાલીમાર્થાને રૂબરૂ સાંભળ્યાં બાદ આચાર્યશ્રીએ તે તાલીમાર્થાને અભ્યાસ મોકફી પર રાખવા અને ત્યારબાદ તેમને બરતરફ કરવા અંગેની વિગતવાર દરખાસ્ત વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીને મોકલી આપવી. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીનો નિર્ણય આખરી ગણાશે.

(૧) કોશન મની / ફી / અનામતની રકમ :

૧.	ઇતાલયની અનામત	રૂ.૨૦૦/- (પરત મળવાપાત્ર)
૨.	કોશન મની	રૂ.૧૦૦/- (પરત મળવાપાત્ર)
૩.	ઓળખ પત્ર ફી	રૂ.૩૦/-
૪.	ગુણપત્રક ફી	રૂ.૨૦/-
૫.	પ્રમાણપત્ર ફી	રૂ.૩૦/-
૬.	પ્રયોગશાળા ફી	રૂ.૨૫૦/-
૭.	ઇતાલયનું ઇલેક્ટ્રોસીટી બીલ ફી	રૂ.૧૫૦૦/-
કુલ:		રૂ.૨૧૩૦/-

(૨) હાજરી :

- (અ) પ્રવેશ મેળવેલ દરેક તાલીમાર્થાને અંતિમ પરીક્ષામાં બેસવા માટે ઓછામાં ઓછી ૮૦% હાજરી જરૂરી રહેશે.
- (બ્ય) કોર્ઝ દરમ્યાન ૮૦%થી ઓછી હાજરી ધરાવતા તાલીમાર્થાને અંતિમ પરીક્ષામાં બેસવા દેવામાં આવતા નથી. પરંતુ માંદગી તેમજ ખાસ કિસ્સામાં કેન્દ્રના વડાની સત્તાની રૂએ ખુટતી હાજરી બાબતે વધુમાં વધુ ૨૦% છૂટછાટ આપી શકાશે.

(૩) સામાન્ય નિયમો :

- (અ) યુનિવર્સિટીના આરોગ્ય કેન્દ્રના ડોક્ટર તેમજ સરકાર માન્ય તબીબી જરૂરી પ્રમાણપત્ર મળેથી પ્રવેશ માન્ય ગણાશે.
- (બ્ય) કોઈપણ તાલીમાર્થા બીમારી કે ચેપી રોગનો ભોગ બનેલ હોય તો ડોક્ટરી પ્રમાણપત્ર સિવાય વર્ગમાં હાજરી આપી શકાશે નહીં.
- (ક) તાલીમાર્થાએ નિયમીત સમયપત્રકમાં હાજરી આપવાની રહેશે. અભ્યાસ દરમ્યાન નિયત પરીક્ષાઓ નિયત સમયે આપવાની રહેશે.

- (૫) જે તાલીમાર્થીની પ્રગતિ સંતોષકારક જણાશે નહી તેમને ગમે તે સમયે તાલીમમાંથી છુટા કરવામાં આવશે.
- (૬) તાલીમ દરમ્યાન કોઈ અંગત મિલકત ગુમ થવા અંગે કે કોઇપણ અકસ્માતની જવાબદારી તાલીમાર્થીની પોતાની રહેશે.
- (૭) જો કોઈ તાલીમાર્થી તાલીમ દરમ્યાન યુનિવર્સિટીના માલમિલકત ને નુકશાન કરશે તો તે જે તે તાલીમાર્થી પાસેથી વસુલાત પાત્ર રહેશે.
- (૮) પ્રવેશ મેળવેલ તાલીમાર્થીને કેન્દ્રમાંથી ઓળખપત્ર આપવામાં આવશે. જે તાલીમ દરમ્યાન જરૂર પડે સંબંધિત અધિકારીશ્રીને બતાવવાનું રહેશે.
- (૯) યુનિવર્સિટીએ નક્કી કરેલ શિસ્તના બધાજ નિયમોનું ચુસ્તપણે પાલન તાલીમાર્થીઓએ કરવાનું રહેશે અને તેમાં વખતોવખત ફેરફાર કરવામાં આવે તો તે તાલીમાર્થીને બંધનકર્તા રહેશે.

(૪) પરીક્ષા :

કોર્ષ દરમ્યાન નીચે મુજબની પરીક્ષાઓ લેવામાં આવશે.

ક્રમ	પરીક્ષા	સમય	ગુણ
૧	આંતરિક બોધ્યીક પરીક્ષા	કોર્ષ શરૂ થયા બાદ એક માસના અંતે	૩૦
૨	આંતરિક પ્રાયોગિક પરીક્ષા	કોર્ષ શરૂ થયા બાદ એક માસના અંતે	૩૦
૩	અંતિમ બોધ્યીક પરીક્ષા	કોર્ષના અંતે	૭૦
૪	અંતિમ પ્રાયોગિક પરીક્ષા	કોર્ષના અંતે	૭૦

- ૪.૧ નાપાસ (ફેઇલ) થયેલા માટે પુનઃ પરીક્ષા : જો કોઈ વિદ્યાર્થી એક અથવા વધારે વિષયોમાં ઉત્તિર્ણ થવા માટે જરૂરી ગુણ મેળવવામા નિષ્ફળ થાય અને તેને નાપાસ જાહેર કરવામાં આવે તો તે વિદ્યાર્થી પુનઃ પરીક્ષામાં બેસી શકશે. પુનઃ પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થી જે વિષયમાં નાપાસ થયો હોય તે વિષયની લેખિત તેમજ પ્રાયોગિક એમ બજે માટેની પરીક્ષા આપવાની

રહેશે. અન્ય વિષયો માટે પરીક્ષા મુક્તિ ગણવામાં આવશે. પરીક્ષા મુક્તિ નહિ રાખનાર વિદ્યાર્થીએ બધા જ વિષયો માટે પુનઃ પરીક્ષામાં બેસવાનું રહેશે.

- ૪.૨ પુનઃપરીક્ષામાં બેસવા માટે બહારના (External/Repeater) વિદ્યાર્થી તરીકે રૂ.૧૦૦/- ફી લેવામાં આવશે.
- ૪.૩ માંદગી કે અન્ય કોઈ ખાસ અનિવાર્ય પ્રકારના કારણો સિવાય જે વિદ્યાર્થી આંતરિક પરીક્ષામાં ગેરહાજર રહે તો તેની ફરી પરીક્ષા લેવામાં આવશે નહીં.
- ૪.૪ નાપાસ થયેલ વિદ્યાર્થી વધુમાં વધુ ત્રણ વખત પરીક્ષા આપી શકશે.
- ૪.૫ તાલીમાર્થાની ગુણપત્રક કે પ્રમાણપત્ર ગુમ થયેલ હોય અને તે કોલેજને ડુપ્લિકેટ ગુણપત્રક કે પ્રમાણપત્ર મેળવવા અરજી કરે તો તાલીમાર્થા પાસે તે અંગેની ફી રૂ.૧૦૦/- લેવાની રહેશે.
- ૪.૬ તાલીમાર્થા સંયુક્ત ગુણપત્રક (Transcripts) માટે કોલેજને અરજી કરે તો તે અંગેની ફી રૂ.૨૦૦/- લેવાની રહેશે.

(૫) મૂલ્યાંકન :

ત્રણ (3) માસના પૂરા સમયના અભ્યાસક્રમમાં આંતરિક અને અંતિમ પરીક્ષાઓ લેવામાં આવશે. સફળ થયેલ ઉમેદવારને ગુણકક્ષા પ્રમાણે તાલીમ સફળતાપૂર્વક પૂરી કર્યાનું પ્રમાણપત્ર આપવામાં આવશે. ગુણકક્ષાનું ન્યુનતમ ધોરણ નીચે મુજબ છે.

ક્રમ	શ્રેણી	ટકા (%)
૧	પાસ શ્રેણી	૩૫.૦૦ થી ૪૮.૯૯
૨	દ્વિતીય શ્રેણી	૫૦.૦૦ થી ૫૮.૯૯
૩	પ્રથમ શ્રેણી	૫૦.૦૦ થી ૬૮.૯૯
૪	વિશેષ શ્રેણી	૭૦.૦૦ ટકા અને તેથી વધુ

છાત્રાલયના નિયમો

1. છાત્રાલય-પ્રવેશ ગુણવત્તાના ધોરણે ઉપલબ્ધ સગવડની મર્યાદાને આધીન રહીને આપવામાં આવશે.
2. ફૂડ પ્રોસેસીંગ ટેકનોલોજી ૩ (ત્રણ) માસના પ્રમાણપત્ર અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારા છાત્રાલયમાં રહેતા દરેક તાલીમાર્થાએ જમવાની વ્યવસ્થા સ્વખર્ચે (જાતે) કરવાની રહેશે.
3. તાલીમાર્થાને આપવામા આવેલ રૂમની સફાઈ પોતે કરવાની રહેશે.
4. વીજળી અને પાણીનો વપરાશ જરૂર પૂરતો જ કરવાનો રહેશે.
5. છાત્રાલયની રૂમો, દિવાલો, પરસાળ અથવા મકાનના કોઇપણ ભાગમાં કોઇપણ જાતના ચિત્રો કે લખાણ લખવા નહિ અને છાત્રાલયની હદમાં નકામી ચીજો ફેકવી નહીં. બિન ઉપયોગી ચીજો કચરાપેટીમાં નાખવી. છાત્રાલયને સ્વચ્છ અને સુધાર રાખવુ એ દરેક તાલીમાર્થાની ફરજ રહેશે.
6. છાત્રાલયનું મકાન રાચરચીલુ કે અન્ય ચીજવસ્તુઓ કાળજીથી વાપરવાની રહેશે.
7. છાત્રાલયમાં કોઇપણ ધુમ્રપાન, દાહક, સ્ફોટક, માદક, કેઝી પદાર્થ કે વિનાશક પદાર્થો તથા હથિયારો રાખવા નહીં.
8. કોઇપણ વિદ્યાર્થીએ રૂમમાં પોતાની પાસે કીમતી વસ્તુઓ જેવા કે મોબાઇલ, દાંડિના રાખવા નહીં.
9. કોઇપણ સંજોગોમાં કુમાર છાત્રાલયમાં સ્ત્રી મહેમાનને અને કન્યા છાત્રાલયમાં પુરુષ મહેમાનને રહેવા દેવામાં આવશે નહીં. પિતા અથવા વાલીને તાલીમાર્થાની મુલાકાત સમયે ગૃહપતિની મંજૂરીથી અધ્વાડિયામાં એકાદ દિવસ માટે છાત્રાલયમાં મુલાકાત આપવામાં આવશે.
10. માંદા પડનાર, ચેપી રોગચાળા અથવા ઇજા પામેલ તાલીમાર્થાની જાણ ગૃહપતિને તરત જ કરવી જેથી તાત્કાલિક સારવારની વ્યવસ્થા થઈ શકે.

11. યુનિવર્સિટી તરફથી આપવામાં આવેલ ઓળખપત્ર દરેક તાલીમાર્થીએ પોતાની પાસે રાખવાનું રહેશે. યુનિવર્સિટીના અધિકૃત અધિકારી જોવા માંગે ત્યારે બતાવવાનું રહેશે.
12. વેકેશન દરમ્યાન ગૃહપતિની મંજૂરી સિવાય કોઇપણ તાલીમાર્થી છાત્રાલયમાં રહી શકાશે નહીં.
13. સાંજે આઠ વાગ્યા પછી ગૃહપતિની મંજૂરી સિવાય છાત્રાલય છોડી શકાશે નહીં.
14. છાત્રાલયના નોકરો પાસે કોઇપણ તાલીમાર્થીએ અંગત કામ કરાવવા નહીં.
15. જે તાલીમાર્થીનો પ્રવેશ તાલીમ કેંદ્રમાંથી રદ કરવામાં આવે તે તાલીમાર્થીએ છાત્રાલયમાં ફાળવેલ રૂમ તાત્કાલિક અસરથી ખાલી કરવાની રહેશે.
16. ગૃહપતિને મદદનીશ ગૃહપતિ કે યુનિવર્સિટી અધિકૃત અધિકારી જ્યારે છાત્રાલયની મુલાકાત લે/તપાસ કરે તે વખતે દરેક રૂમ ખુલ્લી રાખી તાલીમાર્થીએ અંગત સામાનની ચકાસણી કરવા દેવાની રહેશે.
17. તાલીમાર્થીએ રૂમની વીજળીનો બલ્બ/ટ્યુબ પ્રવેશ વખતે ચાલુ હાલતમાં આપવામાં આવશે. ત્યારબાદ તે બિનકાર્યક્ષમ થયે તાલીમાર્થીએ પોતાના ખર્ચે બદલીને રૂમની પરત સોંપણી વખતે ચાલુ હાલતમાં આપવાના રહેશે.
18. તાલીમાર્થીએ શૈક્ષણિક વર્ષ/અભ્યાસ્ક્રમ પૂરો થયે છાત્રાલયની રૂમ, ફર્નિચર તથા અન્ય વસ્તુઓની પરત સોંપણી ગૃહપતિને કરવાની રહેશે. નિયમનું ઉલ્લંઘન કરનાર તાલીમાર્થીની અનામત જપ્ત કરવામાં આવશે.
19. છાત્રાલયમાં દાખલ થતી વખતે રોજીંદી જરૂરીયાતની ચીજવસ્તુઓ તાલીમાર્થીએ લાવવાની રહેશે.
20. ઉપરોક્ત નિયમો ઉપરાંત આણંદ કૃષિ યુનિવર્સિટી તરફથી વખતોવખત અમલમાં આવતા છાત્રાલયના નિયમો તથા જે તે છાત્રાલયના ગૃહપતિ તરફથી સ્થાનિક પરિસ્થિતીને ધ્યાનમાં લઇ ઘડેલ નિયમો છાત્રાલયમાં રહેતા તમામ તાલીમાર્થીને બંધનકર્તા રહેશે.





SCAN for LOCATION

:વધુ માહિતી માટે સંપર્ક:

આચાર્ય અને વિદ્યાશાખાધ્યક્ષશ્રી

ડોલેજ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી એન્ડ બાયો એન્જીનીઝિંગ

આણંદ કૃષી યુનિવર્સિટી, આણંદ - ૩૮૮૧૧૦.

ફોન (અંગ્રેજી) : ૦૨૬૯૨-૨૬૧૩૦૨.